

# ૨૮ માર્ચે ઓપનિંગ મેચમાં RCB - SRH સામે ટકરાશે

**BCCI દ્વારા  
20 IPL મેચોનું  
શેડ્યૂલ જાહેર**

મુંબઈ, તા. ૧૧  
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ ના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ બુધવારે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૨૮ માર્ચે ઓપનિંગ મેચમાં સનરાઈઝર્સ

હેંદરાબાદનો સામનો કરશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષે, આરસીબીના ટ્રોફી સેલિબ્રેશન દરમિયાન, બેંગ્લોરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના પરિણામે અનેક લોકો માર્યા ગયા હતા. ત્યારથી,

આ મેદાન પર કોઈ મેચ યોજાઈ નથી. હવે, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને મેચોનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ ૨૮ માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાના અભિયાનની

શરૂઆત કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે પોતાની પહેલી મેચ રમશે. નોંધનીય છે કે આ ચારેય ટીમોએ આઈપીએલ જીતી છે. રાજસ્થાન રોયલ્સે ૨૦૦૮માં આઈપીએલની પહેલી સીઝન જીતી હતી.

આઈપીએલ ૨૦૨૫ ના ફાઈનલિસ્ટ પંજાબ કિંગ્સ પોતાની પહેલી મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તેઓ મુલ્તાનપુરમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ ૩૧ માર્ચે રમાશે. આઈપીએલ ૨૦૨૬ ના પહેલા તબક્કા માટે બે ડબલહેડર સહિત કુલ ૨૦ મેચનું આયોજન કરાયું છે. બાકીની મેચોની તારીખો દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત પછી નક્કી કરાશે. સાંજની મેચો સાંજે ૭:૩૦ વાગ્યાથી રમાશે. ડબલહેડરના દિવસે, બપોરની મેચ બપોરે ૩:૩૦ વાગ્યાથી શરૂ થશે.

ફેઝ ૧ શેડ્યૂલમાં ટીમો વચ્ચે રમાનારી મેચો	
● ૨૮ માર્ચ, શનિવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઈઝર્સ હેંદરાબાદ, બેંગલુરુ	● ૫ એપ્રિલ, રવિવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, બેંગલુરુ
● ૨૯ માર્ચ, રવિવાર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ	● ૬ એપ્રિલ, સોમવાર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, કોલકાતા
● ૩૦ માર્ચ, સોમવાર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુવાહાટી	● ૭ એપ્રિલ, મંગળવાર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, ગુવાહાટી
● ૩૧ માર્ચ, મંગળવાર પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ, મુલ્તાનપુર	● ૮ એપ્રિલ, બુધવાર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ, દિલ્હી
● ૧ એપ્રિલ, બુધવાર લખનૌ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, લખનૌ	● ૯ એપ્રિલ, ગુરુવાર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, કોલકાતા
● ૨ એપ્રિલ, ગુરુવાર કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હેંદરાબાદ, કોલકાતા	● ૧૦ એપ્રિલ, શુક્રવાર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુવાહાટી
● ૩ એપ્રિલ, શુક્રવાર, ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, ચેન્નાઈ	● ૧૧ એપ્રિલ, શનિવાર પંજાબ કિંગ્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હેંદરાબાદ, મુલ્તાનપુર
● ૪ એપ્રિલ, શનિવાર, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી	● ૧૧ એપ્રિલ, શનિવાર ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ
● ૪ એપ્રિલ, શનિવાર, ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, અમદાવાદ	● ૧૨ એપ્રિલ, રવિવાર લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ, લખનૌ
● ૫ એપ્રિલ, રવિવાર, સનરાઈઝર્સ હેંદરાબાદ વિરુદ્ધ લખનૌ સુપરજાયન્ટ્સ, હેંદરાબાદ	● ૧૨ એપ્રિલ, રવિવાર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ

## વિશ્વમાં ક્રિકેટના વિકાસને પ્રોત્સાહન આપવા રકમમાં વધારો

આઈસીસી દ્વારા વર્લ્ડકપ વિજેતા ભારતને રૂ. ૨૫ કરોડ અને કીવિને ૧૩ કરોડનું ઈનામ દ. આફ્રિકા, ઇંગ્લેન્ડને અનુક્રમે ૯૨.૪ અને ૮૯.૬ મિલિયન મળ્યા



દુબઈ, તા. ૧૧  
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીતનારી ભારતીય ટીમ પર ૧૫ વર્ષા થઈ છે. બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી ખેલાડીઓને જીઈ ૧૧.૨૫ મિલિયનની રેકૉર્ડબ્રેક કુલ ઈનામી

ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચ ૯૬ રનથી જીતીને આ ફોર્મેટમાં સતત ત્રીજો ખિતાબ મેળવ્યો. ૨૫-અપ ન્યૂઝીલેન્ડને US\$1,422,692 (આશરે રૂ. ૧.૩ કરોડ) ઈનામ આપવામાં આવ્યું છે. સેમિફાઈનલમાં સ્થાન મેળવનારા દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડને અનુક્રમે આશરે ૯૨.૪ મિલિયન અને ૮૯.૬ મિલિયન મળ્યા છે. અન્ય ટીમોમાં, વેસ્ટ ઈન્ડિઝને US\$538,269 મળ્યા. ખેલાડીઓને વધુ નાણાકીય પ્રોત્સાહન આપવા અને વિશ્વમાં ક્રિકેટના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ૨૦૨૪ થી ટુર્નામેન્ટ માટે ઈનામી રકમમાં વધારો કરાયો છે.

ટી૨૦ વર્લ્ડકપમાં ભારતનો ઐતિહાસિક વિજય હવે નવીન આઈસીસી રેકિંગમાં તિબિંબિત

અભિષેક શર્મા પ્રથમ સ્થાને યથાવતઃ ઈશાન કિશન બીજા ક્રમે

દુબઈ, તા. ૧૧  
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૬માં ભારતનો ઐતિહાસિક વિજય હવે નવીનતમ આઈસીસી રેકિંગમાં પ્રતિબિંબિત થાય છે. કેપ્ટન સુર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતે અમદાવાદમાં ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને સતત બીજો અને ત્રીજો ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો. આ પ્રભાવશાળી અભિયાન બાદ ભારતીય ખેલાડીઓએ નવીનતમ આઈસીસી ટી૨૦ આંતરરાષ્ટ્રીય બેટિંગ રેકિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. યુવા બેટ્સમેન અભિષેક શર્મા અને ઈશાન કિશન બેટ્સમેનોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અભિષેક શર્મા ટી૨૦ આંતરરાષ્ટ્રીય બેટિંગ રેકિંગમાં ટોચ પર છે. ટી૨૦ વર્લ્ડ કપમાં

શાનદાર પ્રદર્શન કરનાર ઈશાન કિશન રેકિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ઈશાને તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત કરી છે અને હવે તે અભિષેક શર્માથી માન ચાર રેટિંગ પોઈન્ટ પાછળ છે. બે ભારતીય બેટ્સમેન હવે ટી૨૦ આંતરરાષ્ટ્રીય રેકિંગમાં પ્રથમ અને બીજા સ્થાને છે, ટોચના ૧૦ ટી૨૦ બેટ્સમેનોમાં, અભિષેક અને ઈશાન ઉપરાંત, તિલક વર્મા અને સુર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. બેટ્સમેનોમાં પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન ત્રીજા સ્થાને છે. ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી નંબર વનથી બીજા સ્થાને સરકી ગયો છે. અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન હવે બોલરોના રેકિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે. ઓલરાઉન્ડર રેકિંગમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા પ્રથમ સ્થાને યથાવત છે, જ્યારે ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે.

## જેનિક સિનરે બે ટાઇટ ટાઇ-બ્રેકમાં બેઆઓ ફોન્સેકાને હરાવ્યો

ઈન્ડિયન વેલ્સ ઓપનમાં સિનર ફોન્સેકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં

નવી દિલ્હી, તા. ૧૧  
વિશ્વના બીજા ક્રમાંકિત ખેલાડી જેનિક સિનરે બ્રાઝિલના જોઆઓ ફોન્સેકાને હરાવીને ઈન્ડિયન વેલ્સ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. સિનરે બે ટાઈટ ટાઈ-બ્રેકમાં પોતાનો સંયમ જાળવી રાખ્યો અને ફોન્સેકાને ૭-૬ (૬), ૭-૬ (૪) થી હરાવ્યો. આ વિજય સાથે, સિનર ૨૦૨૪ ની શરૂઆત થી ૧૨ રમાયેલી ૧૨ એટીપી માસ્ટર્સ ૧૦૦૦ ટુર્નામેન્ટમાંથી ૧૧ ની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો. આ સિનરનો ૯૭મી માસ્ટર્સ ૧૦૦૦ મેચ જીત પણ હતી. આ જીત સાથે, તેણે તે સ્તરે ઇટાલિયન ખેલાડી દ્વારા સૌથી વધુ જીત માટે સાથી ઇટાલિયન ફેબિયો ફોગ્ગીનીને પાછળ છોડી દીધો. સિનરે શરૂઆતના સેટ ટાઈ-બ્રેકમાં જબરદસ્ત સંયમ દર્શાવ્યો, ગતિ ફેરવતા પહેલા ત્રણ સેટ પોઈન્ટ બચાવ્યા. જોકે પછીથી તે બીજા સેટમાં ૫-૨ થી આગળ રહ્યા બાદ મેચને સર્વ કરવાની તક ગુમાવી બેઠો, પણ ટાઈ-બ્રેકની મહત્વપૂર્ણ ક્ષણોમાં ઇટાલિયન ખેલાડીએ ફરીથી પોતાનું શ્રેષ્ઠ ટેનિસ રમ્યું અને વિજય સ્વપ્નાં પૂર્ણ કર્યાં. શરૂઆતનો સેટ સ્પર્ધાત્મક હતો, જેમાં બંને ખેલાડીઓ મર્યાદિત બ્રેક તકોને રૂપાંતરિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. સિનરે સતત પાંચ પોઈન્ટ જીતીને સેટ પોતાના નામે કર્યો. ક્વાર્ટર ફાઈનલમાં સિનરનો મુકાબલો અમેરિકન લર્નર ટિએન સામે થશે.

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY. THIS IS NOT A PROSPECTUS ANNOUNCEMENT AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION DIRECTLY OR INDIRECTLY, OUTSIDE INDIA.

Rajputana Stainless Limited

# RAJPUTANA STAINLESS LIMITED

(TO BE LISTED ON THE MAIN BOARD OF BSE AND NSE)

Our Company was incorporated as 'Rajputana Steel Castings Private Limited' under the erstwhile Companies Act, 1956, pursuant to a certificate of incorporation dated on April 2, 1991, issued by the Registrar of Companies, Gujarat, Dadra and Nagar Haveli. Subsequently, pursuant to a special resolution dated June 1, 2007, our Company was converted to a public limited company, and the name of our Company was changed from 'Rajputana Steel Castings Private Limited' to 'Rajputana Steel Castings Limited', and a fresh certificate of incorporation dated June 18, 2007, was issued by the Registrar of Companies, Gujarat, Dadra and Nagar Haveli. Thereafter, the name of our Company was changed to 'Rajputana Stainless Limited' and consequent to change in name, a fresh certificate of incorporation dated July 12, 2007, was issued by the Registrar of Companies, Gujarat, Dadra and Nagar Haveli. For details of change in the name and registered office of our Company, see "**History and Certain Corporate Matters**" on page 275 of the Red Herring Prospectus ("**RHP**" or "**Red Herring Prospectus**") dated February 27, 2026 ("**RHP**") filed with the RoC at Ahmedabad, Gujarat.

Corporate Identity Number: U27109GJ1991PLC015331

Registered Office: 213, Madhwas, Halol Kalol Road, Kalol, Panchmahal, Gujarat – 389 330, India; **Contact Person:** Richa Sanjeev Prashar, Company Secretary and Compliance Officer; Telephone: +91 63 5816 4770; E-mail: compliance@rajputanastainless.com; Website: www.rajputanastainless.com

**OUR PROMOTERS: SHANKARLAL DEEPCHAND MEHTA, BABULAL D. MEHTA, JAYESH NATVARLAL PITHVA AND YASHKUMAR SHANKARLAL MEHTA**

INITIAL PUBLIC OFFERING OF UP TO 2,09,00,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH ("EQUITY SHARES") OF RAJPUTANA STAINLESS LIMITED ("OUR COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹[●] PER EQUITY SHARE (INCLUDING A SECURITIES PREMIUM OF ₹[●] PER EQUITY SHARE) ("OFFER PRICE") AGGREGATING UP TO ₹[●] LAKH COMPRISING A FRESH ISSUE OF UP TO 1,46,50,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH AGGREGATING UP TO ₹[●] LAKHS BY OUR COMPANY ("FRESH ISSUE") AND AN OFFER FOR SALE OF UP TO 62,50,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH AGGREGATING UP TO ₹ [●] LAKHS ("OFFERED SHARES") BY SHANKARLAL DEEPCHAND MEHTA (THE "SELLING SHAREHOLDER" OR "PROMOTER SELLING SHAREHOLDER"), ("OFFER FOR SALE", TOGETHER WITH THE FRESH ISSUE, THE "OFFER"). THE OFFER WILL CONSTITUTE [●] % OF OUR POST-OFFER PAID-UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY.

DETAILS OF THE SELLING SHAREHOLDER, OFFER FOR SALE AND WEIGHTED AVERAGE COST OF ACQUISITION PER EQUITY SHARE			
NAME OF SELLING SHAREHOLDER	TYPE	MAXIMUM NUMBER OF EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH OFFERED/AMOUNT (₹ IN LAKHS)	WEIGHTED AVERAGE COST OF ACQUISITION PER EQUITY SHARE OF FACE VALUE OF ₹ 10/- EACH (IN ₹)*
Shankarlal Deepchand Mehta	Promoter Selling Shareholder	Up to 62,50,000 Equity Shares of face value of ₹ 10/- each aggregating to ₹[●] Lakhs	0.91

*\*As certified by the Statutory Auditors M/s Ruparel & Bavadiya (FRN:126260W) through certificate dated February 27, 2026. For details of Selling Shareholder, see "Summary of the Offer Document" and "The Offer" on pages 27 and 95 of the RHP, respectively.*

**PRICE BAND: ₹116 TO ₹122 PER EQUITY SHARE OF FACE VALUE OF ₹10/- EACH.**  
**THE FLOOR PRICE IS 11.60 TIMES OF THE FACE VALUE OF THE EQUITY SHARES AND THE CAP PRICE IS 12.20 TIMES OF THE FACE VALUE OF THE EQUITY SHARES**  
**BIDS CAN BE MADE FOR A MINIMUM OF 110 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH AND IN MULTIPLES OF 110 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10/- EACH THEREAFTER.**

**BID / OFFER PROGRAMME**

**LAST DAY FOR WITHDRAWAL OF BIDS: MONDAY, MARCH 16, 2026**

**THE OFFER IS BEING MADE THROUGH THE BOOK BUILDING PROCESS IN ACCORDANCE WITH REGULATION 6(1) OF THE SEBI ICDR REGULATIONS, 2018.**  
**THE EQUITY SHARES OF THE COMPANY WILL GET LISTED ON THE MAIN BOARDS OF BSE LIMITED AND NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED. BSE LIMITED IS THE DESIGNATED STOCK EXCHANGE.**  
**• QIB PORTION: NOT MORE THAN 10% OF THE OFFER • NON-INSTITUTIONAL PORTION: NOT LESS THAN 27% OF THE OFFER • RETAIL PORTION: NOT LESS THAN 63% OF THE OFFER**

**NOTICE TO INVESTORS FOR OPTION OF WITHDRAWAL OF BIDS**

We understand that unsolicited emails and video material making invitation to participate in the Initial Public Offering ("IPO" / "Issue") of Rajputana Stainless Limited ("Company") have been inadvertently shared by the Company through email to certain individuals and entities.

As directed by the Securities and Exchange Board of India vide its letter bearing HO/49/11/11(14)2025-CFD-RAC-DIL2 I/6687/2026 dated March 11, 2026, we wish to bring to attention of the investors that all investors/bidders (all categories/sub categories), have an option to withdraw their Bids on March 12, 2026 (Thursday), March 13, 2026 (Friday) and March 16, 2026 (Monday) between 10:00 AM to 5:00 PM (Indian Standard Time) on the said days. The above-mentioned option to withdraw can be exercised by submitting a request for the same to the concerned Designated Intermediary, who shall assist in such withdrawal of Bid cum Application Form.

In the event that an investor does not exercise the option to withdraw their Bid within the aforesaid period, such Bid shall be deemed to continue to remain valid and shall be considered for the purposes of allotment in accordance with the provisions of the Red Herring Prospectus dated February 27, 2026 and the applicable laws.

**Investors/bidders should further note that Bidding in the Offer is closed on Wednesday, March 11, 2026, and accordingly no further Bids will be accepted in the Offer.** Any Bids, after the Bid/Offer closure will be rejected. Further, no revision or addition or modification in the bids will be allowed during the aforesaid bid withdrawal period i.e. March 12, 2026 (Thursday), March 13, 2026 (Friday) and March 16, 2026 (Monday).

For further details in relation to the withdrawal of Bid cum Application Form, please contact the **Registrar to the Offer** i.e., KFin Technologies Limited at, Telephone: +91 40 6716 2222 / 1800 309 4001, E-mail: rsl ipo@kfintech.com and Investor grievance email: einward.ris@kfintech.com.

Investors should note the revised indicative timetable in respect of the Offer is set out below:

Event	Indicative Date
Finalisation of Basis of Allotment with the Designated Stock Exchange	Tuesday, March 17, 2026
Initiation of refunds / unblocking of funds from ASBA Account***	Wednesday, March 18, 2026
Credit of the Equity Shares to depository accounts of Allottees	Wednesday, March 18, 2026
Commencement of trading of the Equity Shares on the Stock Exchanges	Thursday, March 19, 2026

**\*\*\*In case of (i) any delay in unblocking of amounts in the ASBA Accounts (including amounts blocked through the UPI Mechanism) exceeding two Working Days from the Bid/Offer Closing Date for cancelled/ withdrawn/ deleted ASBA Forms, the Bidder shall be compensated by the SCSB responsible for causing such delay in unblocking at a uniform rate of ₹100 per day or 15% per annum of the Bid Amount, whichever is higher from the date on which the request for cancellation/ withdrawal/ deletion is placed in the Stock Exchanges bidding platform until the date on which the amounts are unblocked (ii) any blocking of multiple amounts for the same ASBA Form (for amounts blocked through the UPI Mechanism), the Bidder shall be compensated by the SCSB responsible for causing such delay in unblocking at a uniform rate ₹100 per day or 15% per annum of the total cumulative blocked amount except the original application amount, whichever is higher from the date on which such multiple amounts were blocked till the date of actual unblock; (iii) any blocking of amounts more than the Bid Amount, the Bidder shall be compensated by the SCSB responsible for causing such delay in unblocking at a uniform rate of ₹100 per day or 15% per annum of the difference in amount, whichever is higher from the date on which such excess amounts were blocked till the date of actual unblock; (iv) any delay in unblocking of non-allotted/partially allotted Bids, exceeding two Working Days from the Bid/Offer Closing Date, the Bidder shall be compensated at a uniform rate of ₹100 per day or 15% per annum of the Bid Amount, whichever is higher from the entire duration of delay exceeding two Working Days from the Bid/ Offer Closing Date by the SCSB responsible for causing such delay in unblocking. The BRLM shall, in their sole discretion, identify and fix the liability on such intermediary or entity responsible for such delay in unblocking. The BRLM shall be liable for compensating the Bidder at a uniform rate of ₹100 per day or 15% per annum of the Bid Amount, whichever is higher from the date of receipt of the investor grievance until the date on which the blocked amounts are unblocked. The Bidder shall be compensated in the manner specified in the SEBI ICDR Master Circular.**

Further, the Investors are requested to refer the risk factor number 83 "*The Offer price of our Equity Shares may not be indicative of the market price of our Equity Shares after the Offer and the market price of our Equity Shares may decline below the Offer Price and you may not be able to sell your Equity Shares at or above the Offer Price.*" on page 89 of RHP. Further, the current market price of some securities listed pursuant to certain previous issues managed by the BRLM is below their respective issue prices on page 439 of RHP, before making any investment decision in respect to the Offer.

Please note that capitalized terms used and not defined herein shall have the respective meaning ascribed to them in the Red Herring Prospectus dated February 27, 2026 ("**RHP**").

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP.

Place: Kalol, Gujarat  
Date: March 11, 2026

For RAJPUTANA STAINLESS LIMITED  
On behalf of the Board of Directors

Sd/-  
Richa Sanjeev Prashar  
Company Secretary and Compliance Officer

RAJPUTANA STAINLESS LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its Equity Shares and has filed a RHP dated February 27, 2026 with the RoC. The RHP is made available on the website of the SEBI at www.sebi.gov.in as well as on the website of the BRLM i.e., Nirbhay Capital Services Private Limited at www.nirbhaycapital.com, the website of the NSE at www.nseindia.com and the website of the BSE at www.bseindia.com and the website of the Company at www.rajputanastainless.com. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risks, please see the section "**Risk Factors**" beginning on page 40 of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision and must rely on RHP filed by the Company with the RoC, SEBI and Stock Exchanges and their own examination of our Company and the Offer.

The Equity Shares have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "**U.S. Securities Act**"), and may not be offered or sold within the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are only being offered and sold outside the United States in 'offshore transactions' in reliance on Regulation S the U.S. Securities Act and the applicable laws of the jurisdiction where such offers and sales occur.

CONCEPT

L

O

K

S

A

T

A